

માનસિક સ્વાસ્થ્ય માટેનો વૈજ્ઞાનિક અભિગમ

ડૉ. જ્યેશ જે. શેઠ

૨૧મી સદીની હરપણકાળમાં આજનો માનવી અનેક સમસ્યાઓથી પેરાયેલો છે. દરેકને આવતીકાલના ભવિષ્યની ચિંતા કોઈ ખાય છે. જે આજના માનવીને માનસિક અને શારીરિક ઉદ્દેશ આપે છે. આવા સમયે આપણી પાસે એવો કોઈ જદુઈ ઉપાય તો નથી જ પરંતુ આપણી પ્રાર્થના, ધ્યાન, યોગ, કીર્તન વગેરેનો હિન્દુચર્ચામાં ઉપયોગ આપણને જરૂરથી માનસિક સંતાપ, અંજંપાણી દૂર રાખી શકે છે તેવું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે.

આલબાઈ આઇન્સ્ટાઇને જ્ઞાનાયું હતું કે હવે પછીનો સમય પહેલાં કરતાં ઘણી બધી રીતે જુદી પડે છે. જેમાં વૈજ્ઞાનિક શોધખોળોને આ સમયને અદ્ભુત સહળતાઓ અપાવી છે. પરંતુ એ ભૂલવા જેવું નથી કે માત્ર જ્ઞાનકારી અને કોશલ્ય આ માનવજીતને ગૌરવભરી અને આનંદમયી કિંદળી આપી શકે નહીં. આપણને જે જ્ઞાન ભગવાન જુદ, મહાવીર, જિસસ, મોહેર, વલ્લભાચાર્ય કે ગાંધીજી પાસેથી મળ્યું છે તે કોઈ પણ ભૌતિક ગ્રાનિ કે સિદ્ધ કરતાં ઘણું વધારે છે. સદીઓથી વેદો દ્વારા કહેવાયું છે કે મંત્રોચ્ચાર, ધ્યાન, યોગાસનો કે પ્રાર્થના જ સાચી ખુશી કે પવિત્રતા ભરી કિંદળી આપી શકે છે. તેમજ આ દ્વારા ઘણા રોગ, ખામી કે તકલીફોમાંથી છુટકારો માણી શકે છે.

પૂ. શ્રી મોટાએ તેમની વાઈની તકલીફ સતત પ્રાર્થના દ્વારા જ દૂર કરી હતી. પરંતુ પ્રાર્થનાની શક્તિ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ન હોવાથી તેને શંકાની રીતે જોવાય છે. પરંતુ

જાણીતા વૈજ્ઞાનિક એન્દ્ર્યુ ન્યૂબર્જના સંશોધનાત્મક અભ્યાસ કે જે યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયામાં હાથ ધરવામાં આવેલ તે મુજબ ધ્યાની અવસ્થામાં કે પ્રાર્થના, યોગાસન પછી મગજના જુદા જુદા ભાગમાં જુદી જુદી રીતના કેરફારો થાય છે. તેમના અભ્યાસ મુજબ ઈશ્વર તરફી લાંબી વિચારધારાથી મગજમાં અમુક ન્યૂરો સાર્કિટ થાય છે. જે મુક્કમ અનુભવો - અનુભૂતિઓ માટે આપણી દિનિને નમનીય બનાવે છે. આ દ્વારા પરિસ્થિતિ, વસ્તુઓ કે સંજોગો તરફથી દર્શિ અને માન્યતાઓ બદલાય છે. અને જે આપણે ઈશ્વરના અસ્તિત્વમાં માનતા હો જે તો આપણું માનસ સત્ય માટે તૈયાર થાય છે.

જર્નલ ઓફ ડેમિલી સાયકોલોજી- ૨૦૦૮માં વૈજ્ઞાનિક ખૂબ અને લોરેન્સે બતાવ્યું છે કે કીર્તન કિયાનાં આઈ અઠવાઉયાં પછી મગજના કોષો "Prefrontal Cortex" ની કિયાચિલતામાં અદ્ભુત વધારો નોંધાયો છે. આ મગજનો એ ભાગ છે કે વ્યક્તિને તેના કાર્ય બાબત વધુ સ્પષ્ટતા તેમજ એકાગ્રતા પ્રદાન કરે છે. મગજના રેઝિયો એકટીવ સ્કેન દ્વારા જ્ઞાનવા મળ્યું છે કે "Anterior cingulate" પ્રાર્થનાથી વધુ કાર્યદક્ષ બન્યું છે, લાગણીઓ વધુ નિર્ધારિત બની છે, અને પાદાર્જિલ કે મગજના વિકાસમાં પણ વધારો નોંધાયો છે. ઉપરાંત મગજનો આ ભાગ વૃદ્ધાવસ્થામાં પણ વધુ કાર્યદક્ષ બને છે, જે વૃદ્ધાવસ્થાની નકારાત્મક અસરોથી સુરક્ષિત બનાવે છે.

Prefrontal Cortex અને Anterior

Cingulate areaની વધુ કિપાશીલતાથી ડિપેશનમાં ઘટાડો નોપાવાની સાથે પાદશક્તિ અને કાર્યદક્ષતામાં વધારો થયેલ જોવા મળે છે. આ રીતે જોવા જઈએ તો પાર્કિન્સન્સ કે અલાઇંમર જોવા રોગમાં શરીર તથા મનની મેટાનોલીક કિપામાં સામાન્ય રીતે ઘટાડો થાપ છે જે ધ્યાન-પ્રાર્થના દ્વારા તેની નકારાત્મક અસરો નાખું કે ઘટાડી શકે છે.

નીજી એક અભ્યાસમાં નોંધાયું છું કે ધ્યાનનાં આઠ અથવા તિપામાં મગજની અમુક ચોક્કસ સર્કિટ જે Prefrontal અને Orbital Frontal lobe, Anterior Cingulate Basal Ganglia અને દેલેમસ સાથે જોડાયેલી છે., તેની કાર્યદક્ષતામાં વધારો નોંધાયો છે.

મગજની લા સર્કિટનું સીધું નિયંત્રણ આંતરમન, મનની ચોક્કસાઈ, સમજની સ્પષ્ટતા, વાસ્તવિકતા સાથેનો સંબંધ, જ્ઞાન કે જાગીરદિત કાર્ય દ્વારા, સફદ્યતા, કરુણા, સંતુલિત લાગણીનું અને કોષ તથા ડર ઉપર કાબુ જોવી બાબતો ઉપર છે. તેની વિરુદ્ધ મગજની આ સર્કિટમાં ખામી કે ખરાબી, ડિપેશન, ઉતેજના ગેરવર્તણું કે મનોરોગ નોતરે છે.

કંતા આટલું જ નહીં પણ કે માઝસ દરોજ ૧૨ મિનિટના યોગાભ્યાસ પછી ધ્યાન કરે છે તેના Parietal Lobeની કિપાશીલતા ઉપર સકારાત્મક અસર થાપ છે. જે વિકિત પોતાપણાની સભાનતાની લાગણી સાથે સંકાયેલ છે. નન્સ અને બુદ્ધિસ્થો (Buddhist)ના મનોવિશ્વેચણમાં એ સત્ય બસાર આવ્યું છે કે ધ્યાન દ્વારા 'સુ' પણામાંથી છુટકારો થઈ વેચિક એકતા સથાપ છે. અને જે દ્વારા વસ્તુઓ પ્રત્યેનું વિચારાગાંભીર કે તેના તરફી વલફામાં બદલાવ આવે છે. આમ, વિકિતની તત્ત્વ

વલફાની વિપરીત સંજોગો વચ્ચે અનેકવિધ કાર્ય કરવાની દ્વારા તેણવાય છે. જેને સાધકોલોજીમાં 'Flow' કહેવાય છે. આમ ધ્યાન, ધોગ કે પ્રાર્થનાથી વિકિતની ઉચ્ચ એકાગ્રતા તેણવાય છે. તથા cerebellumની સંકિપત્રાથી વિકિતમાં સ્થિરતા અને સભાનતા વધે છે. યોગાસનોમાં કરતાં આસનો અને મુદ્રા મગજના સંતુલનો સાથે સંબંધિત છે. તેનાથી મગજના ઊંડાણમાં આવેલી basal gangliaની વાતાવરિત દ્વારા પાદશક્તિ, સ્વર્ણ વર્તણું, અને માનસિક સ્વર્ણતામાં વધારો થાપ છે.

આમ ચેતાતંત્રના પ્રાપોગિક અભ્યાસમાં એ સાંબિત થાયું છે કે ધ્યાનથી Visual Scanning, Visual Motor co-ordination અને Visual spacial abilityમાં ૫૦ %નો વધારો થાપ છે જે વૃદ્ધાવસ્થા તથા બાળકોમાં જોવા મળતી માનસિક અસ્વસ્થામાં ખૂબ જ ઉપયોગી થાપ છે. આથી જ આજે પદ્ધિમના દેશોમાં જાહેર અને ખાનગી હોસ્પિટલ્સમાં પ્રાર્થના અને યોગાસનોને સારવારની એક પ્રક્રિયા ગણવામાં આવે છે. અને 'Holistic - Healing'ના અલગ વિભાગ દ્વારા માનસિક અસ્વસ્થાના રોગોમાં દ્વારાની સારવારનો એક ખાગ ગણવામાં આવે છે. જેને આપણા દેશમાં ગંગારિતાથી અમલમાં મૂકવાની જરૂર છે. Experimental Brain Research - 2007 અને European Journal of Neuroscience - 2006ના અંકમાં એક અભ્યાસ દ્વારા એ સાંબિત કરવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓમાં ઉતેજના, દંતશાસ્સા, ગલબામણ કે આત્મ-વિશ્વાસને અભાવ હતો તેઓને ઊડા શાસથી ઘણો કાયદો જોવા મળેલ અને તે વિદ્યાર્થીઓ વધારે સર્કિય અને આત્મવિશ્વાસવાળા જોવા મળેલ હતા.

નોબલ લ્યુરેટ એરીક કેન્નીલે પણ સાચિત છે. જે દ્વારા ફદ્યના પલકારા ઉપર પણ કર્યું છે કે મગજના કોષોનો વિકાસ કરારેય હકારાત્મક, સશક્ત અને સંવાદી અસર કરે અટકતો નથી પરંતુ વ્યક્તિની આત્મરિક અને સ્વિટિના બદલાવ મુજબ મગજના કોષોમાં ફેરફાર થાય છે. જે મગજના exoાઇનો વિકાસ કરે છે. અને તેનાથી મગજના એક ભાગમાંથી સંદેશા બીજી ભાગમાં મોકલી શકાય છે. ખાન એ મગજની રાસાયણિક તેમજ જૈવિક ડિયામાં બદલાવ લાવીને વ્યક્તિની કોશલ્યતામાં વધારો કરે છે. કીર્તનાંડિયા પણ એક ભાગ છે જેમાં ત્રણ આયામો સંકળાયેલા છે. શાસોચ્છવાસ, અવાજ અને ઉલનચલન. આ ત્રણ વસ્તુનું સભાનપણે સંતુલિત નિયંત્રક,

માનસિક તથાવ, બ્લડપ્રેશર અને ઊંઝના ઘટાડે છે. તો સામે પણ સભાનતા અને ડિયારીલતાનો વપારો મંત્રોચ્ચારથી જોવા મળે

છે. જે દ્વારા ફદ્યના પલકારા ઉપર પણ કર્યું છે કે મગજના કોષોનો વિકાસ કરારેય હકારાત્મક, સશક્ત અને સંવાદી અસર કરે અટકતો નથી પરંતુ વ્યક્તિની આત્મરિક અને સ્વિટિના બદલાવ મુજબ મગજના કોષોમાં ફેરફાર થાય છે. જે મગજના exoાઇનો વિકાસ કરે છે. અને તેનાથી મગજના એક ભાગમાંથી સંદેશા બીજી ભાગમાં મોકલી શકાય છે. ખાન એ મગજની રાસાયણિક તેમજ જૈવિક ડિયામાં બદલાવ લાવીને વ્યક્તિની કોશલ્યતામાં વધારો કરે છે. કીર્તનાંડિયા પણ એક ભાગ છે જેમાં ત્રણ આયામો સંકળાયેલા છે. શાસોચ્છવાસ, અવાજ અને ઉલનચલન. આ ત્રણ વસ્તુનું સભાનપણે સંતુલિત નિયંત્રક,

માનસિક તથાવ, બ્લડપ્રેશર અને ઊંઝના ઘટાડે છે. તો સામે પણ સભાનતા અને ડિયારીલતાનો વપારો મંત્રોચ્ચારથી જોવા મળે

* * *

ઈન્સ્ટિટ્યુટ ઓફ સુમન કોર્નેટીકસ
‘કીજ લાઉસ’, જોધપુરગામ રોડ
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫

■ સાભાર ર્થીકાર ■

● ૨૬/૧૧ ઓપરેશન મુંબઈ :- (૨૬ નવેમ્બરે મુંબઈમાં યેલા આત્મકવાદી હુમલાની ઘટનાઓનું એત્તરાની કલમે આલેખન), મૂલ્ય : અતુલ કુલકણી, અનુ : ડિશોર ગૌડ, પ્રકા : અસુસ્થોદય પ્રકાશન, આંગ્રેઝ અમદાવાદ, પૃષ્ઠ : ૧૩૪ + ૧૬ (તસવીરોનાં પાણાં), મૂલ્ય : રૂ.૧૪૦

● પ્રેમમૂર્તિ શ્રી પૂજાલાલ :- (બક્તકરિ શ્રી પૂજાલાલના ચરિત્રસંકીર્તનનો ગ્રંથ), લે : ડિરીટ ક્લિક્સ, પ્રકા : શ્રી અરવિન્દ મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી અરવિન્દ નિવાસ, દાંદિયા બજાર, વડોદરા-૩૮૦૦૦૧, પૃષ્ઠ : ૩૨૭, મૂલ્ય : રૂ.૧૨૦

● આહિલ મનસૂરી : ગજલને સમર્પિત વ્યક્તિત્વ (કવિ આહિલ મનસૂરીના સાહિત્યસર્જનની ગ્રંથીના) લેખન - સંપાદન : પ્રો. સુમન અજમેરી, પ્રકા : સાગર પલિકેશન્સ, ‘સાગર’, ગુજરાત સમાચાર ચોક, ખાનપુર, અમદાવાદ, પૃષ્ઠ : ૫૮૮, મૂલ્ય : રૂ.૫૦૦

● સુમન અજમેરીની : (વ્યક્તિત્વ અને ફુતિત્વ ખંડ-૨) (સુમન અજમેરી ફુતિઓની વિવિધ સમીક્ષકોએ કરેલા મૂલ્યાંકનનો સંચાલ) સંપાદન : ડે.જગદીશ દવે (લંડન), ડે.જી.ડી. શર્મા પ્રકા : અમદાવાદ, ‘સાગર’, ગુજરાત સમાચાર ચોક, ખાનપુર, અમદાવાદ, પૃષ્ઠ : ૧૨૦૪ મૂલ્ય : રૂ.૫૦૦.